

ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ-૧૮૭૯ ની કલમ-૬૫ હેઠળ [બિનખેતી - રહેણાંક અને વાણિજ્ય]

દુકમ નં. 694/16/13/002/2021

તા. 06/07/2021

વંચાણે લીધા :-

(૧) અરજદારશ્રી હિતેશભાઈ કુલાભાઈ પટેલ

રહે. શાસ્ત્રીજી મહારાજ સોસાયટી, પીપલગ, નડીઆદ, પીપલગ-૩૮૭૩૫૫ ની તા.૦૫/૦૪/૨૦૨૧ ની ઓનલાઇન અરજી
(નં.૬૧૬૧૩૨૦૨૧૦૦૮૯૧) તથા સોગંદનામું

(૨) મુંબઈ જમીન મહેસૂલ કાયદો ૧૮૭૯ ની કલમ - ૪૮, ૬૫, ૬૬ તથા ૬૭

(૩) ગુજરાત જમીન મહેસૂલ નિયમો, ૧૯૭૨ ના નિયમ ૮૧, ૧૦૦, ૧૦૧, ૧૦૨

(૪) સરકારશ્રીના મહેસૂલ વિભાગનાં ઠરાવ નં. બખપ/૧૦૦૬/૪૨૫/ક તા.૦૧/૦૭/૨૦૦૮

(૫) સરકારશ્રીના મહેસૂલ વિભાગનાં પરિપત્ર ક્રમાંક: બખપ/૧૦૨૦૧૮/૩૨૭/ક તા.૦૮/૦૫/૨૦૧૮

(૬) સરકારશ્રીના મહેસૂલ વિભાગના ઠરાવ ક્રમાંક: એસ/ટીપી/૧૨૨૦૯/૭૬૯/૧૧/૬.૧ તા.૩૧/૦૩/૨૦૧૧

(૭) સરકારશ્રીના મહેસૂલ વિભાગનાં ઠરાવ ક્રમાંક: બખપ/૧૦૨૦૧૮/૪૨૫/ક તા.૦૮/૦૧/૨૦૧૯

(૮) સરકારશ્રીના મહેસૂલ વિભાગનાં પરિપત્ર ક્રમાંક: બખપ/૧૦૨૦૧૮/૪૨૫/ક તા.૧૨/૦૨/૨૦૧૯

(૯) નાયબ કલેક્ટર શ્રી (સ્ટેમ્પ ડ્યુટી) નો તા.૨૧/૦૫/૨૦૨૧ નો અભિપ્રાય

મામલતદાર અને કૃષિપંચ શ્રી (ALT) નો તા.૩૧/૦૫/૨૦૨૧ નો અભિપ્રાય

(૧૦) ITCMS પોર્ટલ પરની કેસ વિગત



દુકમ :-

વંચાણે લીધેલ કમ (૧) ની અરજી તથા સોગંદનામા થી અરજદારશ્રી હિતેશભાઈ કુલાભાઈ પટેલ એ મોજે લખવાડ પાટી તા. નડિયાદ શહેર જિ. ખેડા ના સરવે/બ્લોક નં. ૬૯૦/૩ ના ક્ષેત્રફળ ૩,૧૬૦.૦૦ ચો.મી. ની જમીન અંગે ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ-૧૮૭૯ ની કલમ-૬૫ હેઠળ બિનખેતીના હેતુ માટે પરવાનગી આપવા વિનંતી કરેલ છે.

૨. સવાલવાળી જમીનના ગામ નમૂના નં. ૭/૧૨ માં કબજેદારોની વિગત નીચે મુજબ છે.

સરવે/બ્લોક નંબર ટી.પી. નંબર એફ.પી. નંબર	માંગણીનું ક્ષેત્રફળ (ચો.મી.)	કબજેદારોના નામ (ખાતા નં. ૧૩૨૭)	જમીનનો સત્તાપ્રકાર (૭/૧૨ મુજબ)
સરવે/બ્લોક નં. : ૬૯૦/૩ જુનો સરવે/બ્લોક નં. : --- ટી.પી. નં. : --- એફ.પી. નં. : ---	૩,૧૬૦.૦૦	અલકાબેન કુલાભાઈ નાથાભાઈ ની દિકરી કીજલબેન કુલાભાઈ નાથાભાઈની દિકરી ગીતાબેન કુલાભાઈ નાથાભાઈની દિકરી હિતેશભાઈ કુલાભાઈ પટેલ કિરણભાઈ કુલાભાઈ પટેલ અરુણભાઈ કુલાભાઈ પટેલ	ગણીત ધારા કલમ ૪૩ ન.શ.

૩. વસુલ કરવામાં આવેલ કરવેરાની વિગત નીચે મુજબ છે.

બેંકમાં ચલન ભર્યા તા.૦૫/૦૭/૨૦૨૧ નં.૬૭૦૦૦૦૧૩૫૫૧૦૦૩૫૦૫૦૭૨૧૪૫૩૭૧

કરની વિગત	સદર	માંગણીનું ક્ષેત્રફળ (ચો.મી.)	દર રૂ. પ્રતિ ચો.મી.	કુલ રકમ રૂ.
રૂપાંતર કર	569-0035-00-800-01	3,160.00	40.00	1,26,400.00
વિશેષ ધારો	570-0035-00-101-01	3,160.00	0.65	2,054.00
લોકલ ફંડ	574-0029-00-103-01	3,160.00	0.33	1,043.00
શિક્ષણ ઉપકર	575-0045-00-108-01	3,160.00	0.17	537.00
માપણી ફી	577-0029-00-106-01	3,160.00	---	1,200.00

૪. ઉપર્યુક્ત તમામ હકીકતો ધ્યાને લઈ મોજે લખવાડ પાર્ટી તા. નડિયાદ શહેર જિ. ખેડા ના સરવે/બ્લોક નં. 690/3 ના ક્ષેત્રફળ 3,160.00 ચો.મી. ની જમીનને નીચે જણાવેલ શરતોને આધિન ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ-૧૮૭૯ ની કલમ-૬૫ હેઠળ બિનખેતી હેતુ (રહેણાંક અને વાણિજ્ય) માટે પરવાનગી આપવા આથી હુકમ કરવામાં આવે છે.

શરતો :-

- (૧) આ હુકમ મળ્યેથી બે માસમાં "એમ" નમૂનામાં સનદ પ્રાપ્ત થશે.
- (૨) જિલ્લા ઇન્સ્પેક્ટરશ્રી, જમીન રેકર્ડની કચેરીમાં માપણી ફી જમા કરાવેલ છે. જેથી માપણી કરી / કરાવી આ હુકમ આધારે તેમજ મંજૂર થયેલ પ્લાન મુજબ દુરસ્તી પત્રક તૈયાર કરવાનું / કરાવવાનું રહેશે અને દુરસ્તી પત્રકનો મહેસૂલી દફતરે અમલ થયા બાદ જ પ્રશ્નવાળી બિનખેતીની જમીન / પ્લોટનું રજી. દસ્તાવેજથી થયેલ વેચાણ વ્યવહારના અમલ માટે નોંધ પાડવાની રહેશે.
- (૩) અરજદારે પ્રતિ વર્ષે ખેતી સિવાયનો ધારો (વિશેષધારો) દર પ્રતિ ચો.મી. ના રૂ. 0.65 પ્રમાણે રૂ. 2,054.00 તેમજ નિયમ પ્રમાણે લોકલ ફંડ તથા શિક્ષણ સેસ ભરવો પડશે જે અંગેનો દર વખતોવખત ફેરફારને પાત્ર રહેશે.
- (૪) નડિયાદ શહેર નગરપાલિકા એ મંજૂર કરેલા પ્લાન મુજબ બાંધકામ કરવાનું રહેશે અને હુકમ થયા તારીખથી ત્રણ વર્ષમાં બાંધકામ પૂર્ણ કરવાનું રહેશે.
- (૫) સરકારશ્રીના મહેસૂલ વિભાગના ઠરાવ નં. બખપ/૧૦૯૩/૧૦૫૨/ક તા. ૧૩/૦૯/૧૯૯૩ માં ઠરાવ્યા મુજબ સહીયારા / કોમન પ્લોટ અને રસ્તાની જમીન સોસાયટીની માલિકીની અથવા સર્વે પ્લોટ હોલ્ડરની સહીયારી માલિકીની ગણાશે તે ઉપર મુળ માલિકનો કોઈ હકક રહેશે નહિ.
- (૬) સરકારશ્રીના મહેસૂલ વિભાગના તા. ૦૭/૦૮/૧૯૯૧ ના પરિપત્ર નં. બખપ-૧૦૯૧/૧૭૫૬/ક ની જોગવાઈ મુજબ બિન અધિકૃત બાંધકામ બાબતે બાંધકામ નિયંત્રણ કરતી સંબંધિત મહાનગરપાલિકા / શહેરી વિસ્તાર સત્તા મંડળએ ધોરણસરનાં પગલાં લેવાના રહેશે.
- (૭) સદર જમીનમાંથી પેટ્રોલીયમ / પાણીની કે અન્ય કોઈપણ પ્રકારની પાઇપલાઇન પસાર થતી હશે તો તે સંદર્ભે વિકાસ પરવાનગી આપનાર ઓથોરિટીએ સંબંધિતોનું ના-વાંધા પ્રમાણપત્ર મેળવી વિકાસ પરવાનગી આપવાની રહેશે.
- (૮) સરકારશ્રીના મહેસૂલ વિભાગના તા. ૧૨/૦૨/૨૦૧૯ ના પરિપત્ર નં. બખપ/૧૦૨૦૧૮/૪૨૫/ક મુજબની નીચેની શરતોનું પાલન કરવાનું રહેશે.
 ૧. જો અગાઉ ચોકકસ હેતુ માટે પ્રિમિયમ ભરપાઇ થયેલ હોય અને અન્ય હેતુ માટે વિકાસ પરવાનગી માંગેલ હોય/ નકશા મંજૂર કરવાના થતા હોય તો વિકાસ પરવાનગી આપતાં પહેલાં પ્રિમિયમ તફાવત ભરાયાની સંબંધિત સત્તામંડળે ખાતરી કરવાની રહેશે અને ત્યારબાદ જ વિકાસ પરવાનગી આપવાની રહેશે.
 ૨. જીડીસીઆર મુજબ જે તે હેતુ/ ઉપયોગ માટે પરવાનગી મળવાપાત્ર નહિ હોય તો તે ઉપયોગ કરી શકાશે નહિ.
 ૩. ખેતી ઝોનમાં જીડીસીઆર મુજબ જેટલું બાંધકામ મળવાપાત્ર હશે તેટલા જ ક્ષેત્રફળ માટે વિકાસ પરવાનગી આપવાની રહેશે.
 ૪. બિનખેતી પરવાનગી મળ્યા બાદ જો ખાસ મંજૂરી વિના ધાર્મિક ઉપયોગ માટે બાંધકામ કરેલ હશે તો તે શરતભંગ ગણાશે અને તે બાંધકામ દૂર કરવાપાત્ર થશે.
- (૯) સરકારશ્રીનાં મહેસૂલ વિભાગનાં તા. ૦૧/૦૭/૨૦૦૮ ના ઠરાવ નં. બખપ/૧૦૦૬/૪૨૫/ક માં જણાવેલ નીચે મુજબની શરતોનું પાલન કરવાનું રહેશે.
 ૧. જિલ્લા ઇન્સ્પેક્ટરશ્રી, જમીન રેકર્ડ દ્વારા ઇસ્યુ કરાયેલ માપણી શીટ કે જેના ઉપર મૂળ ટિપ્પણની હદ પણ દર્શાવેલ હોવી જોઈએ. રજૂ કરાયેલ પ્લાન તથા લે-આઉટ પ્લાન સક્ષમ કક્ષાએ મંજૂર કરાયેલ હોવી જોઈએ.
 ૨. બાંધકામ શરૂ કરતા પહેલાં બાંધકામનાં નકશા સક્ષમ અધિકારી પાસે મંજૂર કરાવવાના રહેશે. પરંતુ અરજદાર બિનખેતી પરવાનગી મેળવ્યા વગર આવા બાંધકામની રજા ચિઠ્ઠી મેળવી શકશે નહિ.
 ૩. શહેરી વિસ્તાર જ્યાં ટાઉન પ્લાનિંગ સ્કીમ મંજૂર થઇ ગઇ છે ત્યાં જી.ડી.સી.આર. અને ઝોનિંગના નિયમો અનુસાર બાંધકામ કરવાનું રહેશે.
 ૪. મંજૂર થયેલ નકશા મુજબ આરોગ્ય અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ગંદા પાણીનાં નિકાલની જોગવાઈ કરવાની રહેશે.
 ૫. અરજદારે રિબન ડેવલપમેન્ટ રુલ્સ નીચે જે તે રસ્તાનો પ્રકાર ધ્યાને લઈ રસ્તાના મધ્યબિંદુથી બાંધકામ વચ્ચે અંતર જાળવવાનું રહેશે અન્યથા અરજદારની જવાબદારી થશે.
 ૬. ફ્લોર, મિલ, સિનેમા/ ટુરિંગ સિનેમા/ થિયેટર માટે બિનખેતી પરવાનગીના કામે જિલ્લા મેજિસ્ટ્રેટની જરૂરી મંજૂરી મેળવી આગળની કાર્યવાહી કરવાની રહેશે.
 ૭. પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, સી.એન.જી., એલ.પી.જી. પંપ નાંખવા માટે બિનખેતી પરવાનગીના કામે બાંધકામ શરૂ કરતાં પહેલાં જિલ્લા મેજિસ્ટ્રેટની જરૂરી મંજૂરી મેળવી આગળની કાર્યવાહી કરવાની રહેશે.



૯. ઇન્ડિયન એક્સપ્લોઝિવ એક્ટ અન્વયે મેગેનિઝ, ફાયર વર્ક્સ, દારૂખાના માટે બિનખેતીની કાર્યવાહી કરતા પહેલા જિલ્લા મેજિસ્ટ્રેટની જરૂરી મંજૂરી મેળવી આગળની કાર્યવાહી કરવાની રહેશે.
૯. સવાલવાળી જમીન જો રેલવે હદની નજીક હોય તો રેલવેની હદથી નિયમ મુજબ જગ્યા છોડી બાંધકામ કરવાનું રહેશે.
૧૦. સવાલવાળી જમીન ઉપરથી અથવા બાજુમાંથી વીજળી ગ્રિડના તાર/ હાઇટેન્શન પાવર અગર થાંભલા આવેલ હોય ત્યારે તે અન્વયે લાગુ પડતા નિયમોનું પાલન કરવા અને તે મુજબ બાંધકામ કરવાનું રહેશે.
૧૧. બિનખેતી માંગવામાં આવી હોય તેવી જમીન જો એરોડ્રામ આસપાસ નિયમ મુજબની ત્રિજ્યામાં આવતી હોય ત્યારે બાંધકામની ઉંચાઇ તથા એરોડ્રામની દ્રષ્ટિએ જરૂરી એવું ના-વાંધા પ્રમાણપત્ર સિવિલ એવિએશન ખાતા પાસેથી મેળવવાનું રહેશે અને સિવિલ એવિએશન ખાતાના નિયમોનું પાલન કરવાનું રહેશે.
૧૨. ઓ.એન.જી.સી. ના કુવાની નજીકમાં આવેલ જમીનના કિસ્સામાં અરજદારે સંબંધિત નિયમોનું પાલન કરવાનું રહેશે.
૧૩. નર્મદા કેનાલ/ અન્ય સિંચાઇ કેનાલની નજીકમાં આવેલ જમીનની બાબતમાં અરજદારે સૂચિત બાંધકામ માટે જાળવવાના થતાં અંતર અંગેના નિયમોનું પાલન કરવાનું રહેશે.
૧૪. અરજદારે/ જ્યાં જરૂરી હોય ત્યાં કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારના કાયદા નીચે રક્ષિત સ્મારક (Protected Monuments) તરીકે જાહેર કરેલ પ્રાચીન સ્મારકથી નિયમ મુજબનું અંતર જાળવવાની પ્રવર્તમાન જોગવાઈઓનું પાલન કરવાનું રહેશે.
- (૧૦) જો આ જમીન પર કોઇ બેંક/ મંડળીનો બોજો બાકી હોય તો, તે ભરપાઇ કર્યા સિવાય આ મિલકત કોઇપણ પ્રકારે વેચાણ, ભેટ, વસિયત, બાનાખત, ગિરો કરી શકાશે નહિ અને કોઇપણ અન્યને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે માલિકી કે કબજો ભોગવટો તબદીલ કરી શકાશે નહિ.
- (૧૧) પ્રશ્નવાળી જમીનમાં નગરપાલિકા/ મહાનગરપાલિકા/ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા જે શરતોએ પરવાનગી આપવામાં આવશે તે શરતોનું પાલન તથા બાંધકામ કરવાનું રહેશે.
- (૧૨) આ જમીનમાં વરસાદી પાણીના ભુગર્ભ વહન/ સંચય માટે દર મકાન/ બહુમાળી મકાન દીઠ એકના દરે આ જમીનમાં ઉપર પરકોલેટીંગ બોરવેલની વ્યવસ્થા અચૂક કરવાની રહેશે તથા વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરીને બાંધકામ કરવાનું રહેશે.
- (૧૩) પ્રશ્નવાળી જમીનમાં સ્થળે થયેલ બાંધકામ સ્થાનિક સ્વરાજની સંસ્થાના નિયમોનુસાર નહિ હોય તો સ્થાનિક સ્વરાજની સંસ્થા નિયમોનુસાર કાર્યવાહી કરી શકશે. તેમાં આ હુકમથી બાધ આવશે નહિ.
- અરજદારે ઉપરોક્ત શરતોનું પાલન કરવાનું રહેશે. જો તેમાં નિષ્ફળ જશે તો શરતભંગ ગણી સક્ષમ અધિકારી કાયદેસરની કાર્યવાહી કરશે.
- (૧૪) ઉપરની કોઇપણ શરતનો ભંગ થયેથી જમીન મહેસૂલ કાયદાની કલમ-૬૭ મુજબ શિક્ષાત્મક પગલા લેવામાં આવશે તેમજ બીજી કોઇપણ શિક્ષાને પાત્ર હશે તો તેને બાધ આપ્યા સિવાય કે જે ફરમાવવાનું યોગ્ય લાગે તે પ્રમાણે દંડ અથવા આકાર લઇ સદરજુ જમીનનો કબજો કબજેદાર પાસે ચાલુ રહેવા દઇ શકાશે.
- (૧૫) ઉપરોક્ત શરતોમાં ગમે તે મજફૂર હોય તેમ છતાં, કલેક્ટરશ્રી સદરજુ હુકમ વિરુદ્ધ બાંધેલા અથવા વધારાના કોઇપણ મકાન અથવા છમલાને કલેક્ટરશ્રીએ, આ અર્થે જે મુદત ઠરાવી હોય તે મુદત દરમિયાન તેવી રીતે ખસેડવામાં ન આવે કે સૂચવ્યા મુજબ ફેરફાર ન કરવામાં આવે તો તેમ કરવામાં જે ખર્ચ થાય તે કબજેદાર પાસેથી જમીન મહેસૂલની બાકી તરીકે વસુલ કરવાને મુખત્યાર છે.
- (૧૬) ૧૬.૧ સવાલવાળી જમીનમાં અધિકૃત પ્રવેશ બાબતે લાગુ જમીનમાંથી પ્રવેશ મેળવવાનો થતો હોય તો તે બાબતે પરવાનગી/ સંમતિ મેળવી લેવાની જવાબદારી કબજેદારશ્રીની રહેશે. તેમજ જો સવાલવાળી જમીન પાસેથી ગ્રામ્ય માર્ગ/ જીલ્લા માર્ગ/ મુખ્ય જીલ્લા માર્ગ/ રાજ્ય ધોરી માર્ગ/ દાંડી માર્ગ/ રાષ્ટ્રીય ધોરી માર્ગ તેમજ અન્ય કોઇ માર્ગ પસાર થતો હોય તો તે રસ્તામાંથી પ્રવેશ મેળવવાનો થતો હોય તો સક્ષમ અધિકારીશ્રી પાસેથી ના વાંધા પ્રમાણપત્ર મેળવી લેવાની જવાબદારી કબજેદારશ્રીની રહેશે તથા સવાલવાળી જમીનના કોઇપણ હિસ્સો સરકારી સંસ્થા કે અન્ય કોઇ સંસ્થા ધ્વારા સંપાદન અથવા તો વપરાશ હેતુ સંપાદન કરવામાં આવેલ હોય તો તે સંપાદન કરનાર સંસ્થા/કચેરી પસેથી ના વાંધા પ્રમાણપત્ર મેળવી લેવાની જવાબદારી કબજેદારશ્રીની રહેશે.
- ૧૬.૨ રહેણાંક/વાણિજ્ય હેતુ માટે પ્રીમીયમ ભરપાઇ થયેલ હોય અને અન્ય હેતુ માટે વિકાસ પરવાનગી માંગેલ હોય/નકશા મંજૂર કરવાના થતા હોય તો વીકાસ પરવાનગી આપતા પહેલા પ્રીમીયમ તફાવત ભરાયાની સંબંધિત સત્તામંડળને ખાતરી કરવાની રહેશે અને ત્યારબાદ જ વીકાસ પરવાનગી આપવાની રહેશે.
- ૧૬.૩ જીડીસીઆર મુજબ જે હેતુ/ ઉપયોગ માટે પરવાનગી મળવાપાત્ર નહી હોય તો તે ઉપયોગ કરી શકાશે નહી.
- ૧૬.૪ ખેતી ઝોનમાં જીડીસીઆર મુજબ જેટલું બાંધકામ મળવાપાત્ર હશે તેટલા જ ક્ષેત્રફળ માટે વીકાસ પરવાનગી આપવાની રહેશે.
- ૧૬.૫ બીનખેતી પરવાનગી મળ્યા બાદ જો ખાસ મંજૂરી વિના ધાર્મિક ઉપયોગ માટે બાંધકામ કરેલ હશે તો તે શરતભંગ ગણાશે અને તે બાંધકામ દુર કરવાપાત્ર થશે.

વધુમાં ઉપર્યુક્ત શરતોને આધીન અરજદાર દ્વારા રજૂ થયેલ સોગંદનામાની વિગતોમાં તેઓ દ્વારા જાહેર કરેલી હકીકતોને આધારે સવાલવાળી જમીનના બિનખેતી ઉપયોગ માટે પરવાનગી આપવામાં આવે છે.



(ક. એલ. બચાણી)
કલેક્ટર, ખેડા

આર.પી.એ.ડી.

પ્રતિ,

હિતેશભાઈ કુલાભાઈ પટેલ

શાસ્ત્રીજી-મહારાજ સોસાયટી

પીપલગ

નડીયાદ

પીપલગ-387355

નકલ રવાના:-

૧. મુખ્ય અધિકારીશ્રી, નડિયાદ શહેર નગરપાલિકા

૨. મામલતદારશ્રી તા. નડિયાદ શહેર જિ. ખેડા (હુકમનો અમલ ગામ દફતરે રેકર્ડ ઓફ રાઈટ્સ મુજબ કરાવવા શાગ.)

૩. જિલ્લા ઇન્સ્પેક્ટરશ્રી જમીન રેકર્ડ જિ. ખેડા

૪. તલાટીશ્રી લખવાડ પાર્ટી તા. નડિયાદ શહેર જિ. ખેડા તરફ.

૫. નાયબ કલેક્ટરશ્રી, પ્રાંત કચેરી ખેડા

૬. નાયબ મામલતદારશ્રી ઇધરા, મામલતદાર કચેરી, નડીયાદ શહેર

* આ હુકમની ઇ-ધરા કેન્દ્ર, નડિયાદ શહેર માં નોંધ નંબર 26801 થી મોજે.- લખવાડ પાર્ટી તા.- નડિયાદ શહેર જિ.- ખેડા માં નોંધ થયેલ છે.





નડીઆદ નગરપાલિકા

પ્રમુખશ્રી : ૨૫૫૦૨૧૭
 નગરસેવાસદન : ૨૫૫૧૩૭૬/૭૭
 ફેક્સ : ૨૫૫૧૩૭૮
 ઈ-મેલ : nadiadmunicipality@yahoo.com
 વેબસાઈટ : www.nadiadmunicipality.com

પો.બો.નં.-૮
 નગરસેવાસદન
 સરદાર ઉધાન
 નડીઆદ.જી.ખેડા

જાવક નં. NFB/ 039 /2022

તા. ૧૪/૦૬/૨૦૨૨

પ્રોવિઝનલ એન.ઓ.સી

પ્રતિ શ્રી,
 ભાવેશ માણીલાલ પટેલ,
 પાર્ટનર ઓફ રાંધે ડેવલોપર્સ,
 નડિયાદ, તા: નડિયાદ
 જી.ખેડા

વિષય : નકશા પર ફાયર સેફ્ટીનો અભિપ્રાય આપવા બાબત

સંદર્ભ: આપની ઈ.નં. ૨૦૨૫ તા. ૨૬/૦૫/૨૦૨૨ ની નકશા સહિતની ફાઈલ

ઉપરોક્ત વિષય અને સંદર્ભદર્શિત અરજી અન્વયે જાણાવવાનું કે, આપની ઈ.નં. ૨૦૨૫ તા. ૨૬/૦૫/૨૦૨૨ ની

SURVEY NO.- 690 પૈકી ૩ ની જમીન કોમર્શિયલ હેતુ માટે આપના ધ્વારા ફાયર બ્રિગેડ વિભાગ નો અભિપ્રાય માંગવામાં આવેલ જે અન્વયે અમારા અભિપ્રાય મુજબ નીચે મુજબની બાબતો ધ્યાને લઈ અમલીકરણ કરવાનું રહેશે તેમજ ગુજરાત સરકારશ્રી ના શહેરી ગૃહનિર્માણ વિભાગના તા. ૨૧/૦૭/૨૦૧૮ નોટીફિકેશન મુજબ ફાયર સીસ્ટમ લગાવવાની રહેશે અને નીચેના મુદ્દાઓ ધ્યાને લેવાના રહેશે.

- (૧) ઈમારતમાં નિયમ મુજબની સંપૂર્ણ ફિક્સ ફાયર ફાયટીંગ સીસ્ટમ કરવાની રહેશે અને ફાયર એલાર્મ સીસ્ટમ તેમજ સ્પ્રીકલર સીસ્ટમ લગાવવાની રહેશે તેમજ પૂરતા પ્રમાણમાં ઈમરજન્સી એક્ઝિટ અને વેન્ટિલેશન રાખવાનું રહેશે તેમજ પંપહાઉસમાં પંપ લગાવવાના રહેશે.
- (૨) હોઝરીલ અડચણ રહિત સૌથી દૂર ના સ્થાન સુધી સરળતાથી પહોંચે તે મુજબ ની લગાવવાની રહેશે.
- (૩) અલગ અલગ જગ્યાએ ફાયર એક્સટીંગ્યુસરો પુરતા પ્રમાણમાં રાખવાના રહેશે તેમજ ઇલેક્ટ્રિક કેબલોમાં ફાયર પેસીવ સીસ્ટમ કરવાની રહેશે.
- (૪) નિયમ મુજબ ઈમારત માં ચારેબાજુ ફાયરનું મોટું વાહન ફરી શકે તે મુજબના પાકા રોડ બનાવવાનો રહેશે.
- (૫) સરકારશ્રી લાગત સત્તામંડળ અને સક્ષમ અધિકારીઓ ધ્વારા કરવામાં આવેલ લાગત તમામ નિયમો, દિશા નિર્દેશો અને કાયદા મુજબ ફાયર સેફ્ટીનું પાલન કરવાનું રહેશે. વધુમાં અન્ય કોઈ જોખમ જણાશે તો ફાયર અધિકારીની સૂચના મુજબ કામ કરવાનું રહેશે.
- (૬) ગુજરાત રાજ્ય અગ્નિ નિવારણ કાયદા કલમ ૧૨ હેઠળ ફાયર સેફ્ટી ઓફીસર રાખવાના રહેશે.
- (૭) ઈમારતમાં અગર ગ્લાસ ફ્સાડ વાપરવામાં આવ્યા હોય તો તે તમામ ફિક્સ ના રાખતા ઓપનબેલ્ટ લગાવવાના રહેશે.
- (૮) આ ઉપરાંત ફાયર ઓફીસરની દરેક સૂચનાનું પાલન કરવાનું રહેશે.
- (૯) બિલ્ડીંગનું બાંધકામ CGDCR ના નિયમ મુજબ કરવાનું રહેશે.

ઉપરોક્ત સૂચનો અને આપેલ નકશામાં જણાવ્યા મુજબના રેખાચિત્રોનું અને સદર પત્રમાં જણાવ્યા મુજબ પાલન કરવાની શરતે સદર અભિપ્રાય આપવામાં આવે છે.



ફાયર સુપ્રિટેન્ડેન્ટ
 નડીઆદ નગરપાલિકા